



16th July 2022

To,
Department of Corporate Services **BSE Limited,**P.J. Towers, Dalal Street,
Mumbai - 400 001

Security Code: 542460 Security ID: ANUP

Dear Sir/Madam,

To,
Listing Department
National Stock Exchange of India Limited,
Exchange Plaza, 5th Floor Plot No. C/1,
G. Block Bandra - Kurla Complex, Bandra (E),

Mumbai - 400 051

Symbol: ANUP

Sub: Submission of newspaper advertisement in respect of Notice of AGM, remote e-voting information and book closure

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, we enclose herewith the copies of the newspaper advertisement published in The Financial Express (In English - All India edition and in Gujarati - Ahmedabad Edition) on 16<sup>th</sup> July 2022 regarding Notice of AGM, remote e-voting information and book closure for your information and records.

Please take the same on your record.

Thanking you,

Yours faithfully,

For The Anup Engineering Limited

GINEERIN

Chintankumar Patel
Company Secretary

Encl.: As above

**FINANCIAL EXPRESS** 

## SHREE CEMENT LIMITED

REGD. OFFICE: BANGUR NAGAR, BEAWAR - 305 901, DISTT. AJMER (RAJ.) Website: www.shreecement.com E-Mail: shreebwr@shreecement.com Phone: 01462-228101-06 FAX: 01462-228117-19 CIN: L26943RJ1979PLC001935

#### PUBLIC NOTICE

NOTICE is hereby given that following Share Certificate(s) having following Distinctive Nos. held by under-named Member(s) has/have been reported misplaced/lost:

SR. No.	Name of Holder(s)	Certificate Nos.	Distt. Nos.	No. of Shares	
1.	JYOTI PAHUMAL SAJNANI	26985	10827001-10827050	50	
2.	DIPTI P. THAKKAR INDUMATIBEN THAKKAR	19814	2168791-2168840	50	
		7907	1573571-1573620		
3.	A AVOIDA VANTALA D	44890-44891	11722251- 11722350	300	
	LAKSHMI KANTHAM. P	72212	1092171-1092220		
	P. MADAN	92060	12017801 - 12017850		
		94864	10747551 -10747600		
4.	AMRUDDIN A SAREEA	104825-104826	15734001-15734100	200	
	FARZANA K SAREEA	126162-126163	1053571-1053670	200	
5.	SP. KANNAPPAN	17499	2053041-2053090	100	
	CT. SUBRAMANIAN	83096	296571-296620	100	
6.	FARZANA K. SAREEA	126161	1053521-1053570	100	
	KAMRUDDIN A. SAREEA	126164	1053671-1053720	100	

Application(s) has/have been made to the Company by the registered holder(s) of these shares for issue of Duplicate Share Certificate(s) in his/their favor. If no objection is received within a period of 15 days from the date of publication of this Notice, the Company will proceed to issue Duplicate Share Certificate(s).

15° July, 2022

BEAWAR

S. S. Khandelwal Company Secretary ALBERT

For SHREE CEMENT LIMITED

DIVID



## ALBERT DAVID LIMITED

CIN: L51109WB1938PLC009490 Registered Office: 'D' Block, 3rd Floor, Gillander House, Netaji Subhas Road, Kolkata-700001 Tel: 033-2262-8436/8456/8492, 2230-2330, Fax: 033-2262-8439 Email: cvora@adlindia.com, Website: www.albertdavidindia.com

#### NOTICE OF ANNUAL GENERAL MEETING OF THE COMPANY

Notice is hereby given that the 83rd Annual General Meeting ("AGM"/"Meeting") of the Members of Albert David Limited ("the Company") will be held on Tuesday, 9th August, 2022 at 11.00 A.M. (IST) through Video Conferencing/ Other Audio Visual Means ("VC/OAVM"), without the physical presence of the Members at a common venue, in compliance with the applicable provisions of Companies Act, 2013 ("Act") and Rules made thereunder and the Securities and Exchange Board of India (SEBI) (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with Ministry of Corporate Affairs (MCA) Circular No.14/2020 dated 8th April, 2020, Circular No.17/2020 dated 13th April, 2020, Circular No.20/2020 dated 5th May, 2020, Circular No.02/2021 dated 13th January, 2021, Circular No.19/2021 dated 8th December, 2021, Circular No.21/2021 dated 14th December, 2021 and Circular No.02/2022 dated 5th May, 2022 (collectively referred to as 'MCA Circulars') and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May, 2022, issued by the Securities and Exchange Board of India ('SEBI Circulars'), to transact businesses set forth in the Notice convening the AGM ("the Notice").

In terms of the aforesaid MCA Circulars and SEBI Circulars, the copy of the Annual Report of the Company for the financial year ended 31st March, 2022 along with the Notice convening the AGM has already been sent through electronic means to the Members whose email addresses were registered with the Company/RTA/Depository Participant(s). The electronic dispatch of Annual Report to Members has been completed on 14th July, 2022. The said Notice and Annual Report for the financial year ended 31st March, 2022 can also be accessed/downloaded from the "Investor Relations" section in the Company's website at www.albertdavidindia.com. The said documents can also be accessed at website of the Stock Exchanges where the shares of the Company are listed, viz. www.bseindia.com, www.nseindia.com, and at the website of CDSL at www.evotingindia.com.

As the AGM is being conducted through VC/OAVM, for the smooth conduct of proceedings of the AGM, Members who would like to express their views or ask questions during the AGM may register themselves as a Speaker by sending their request mentioning their name, DP ID and Client ID/ folio number, PAN, mobile number at cvora@adlindia.in up to 26th July, 2022 (5:00 P.M. IST) with regard to the financial statements or any other matter to be placed at the Meeting. The Company reserves the right to restrict the number of Speakers depending on the availability of time for the AGM. The Members who do not wish to speak during the AGM but have queries may send their queries up to 26th July, 2022. (5:00 P.M. IST) with regard to the financial statements or any other matter to be placed at the Meeting, mentioning their name, DP ID and Client ID/ folio number, email id, mobile number at cvora@adlindia.in. These queries will be replied to by the Company suitably by email. Those Members who have registered themselves as a Speaker will only be allowed to express their views/ask questions during the meeting. The Company reserves the right to restrict the number of questions and duration of Speakers, as appropriate for smooth conduct of the AGM.

As per the provisions of Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended), the Secretarial Standard and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as amended), Albert David Limited is pleased to provide its Members the facility of remote e-voting as well as e-voting during AGM to exercise their right to vote by electronic means on all businesses specified in the Notice of the AGM through platform

#### provided by Central Depository Services (India) Limited ('CDSL'). The instructions for e-voting are given in the Notice of the AGM. Members are requested to note the following:

- a) Members holding shares either in physical form or in dematerialised form, as on the cut-off date i.e., Tuesday, 2nd August, 2022, shall be eligible to avail the facility of remote e-voting, participation in the AGM through VC/OAVM facility and e-voting during the AGM and exercise their right to vote by electronic means.
- b) The remote e-voting period shall commence on Saturday, 6th August, 2022 from 9:00 a.m. (IST) and end on Monday, 8th August, 2022 at 5:00 p.m. (IST). The remote e-voting shall be disabled for voting thereafter. Once the vote on a resolution is cast, the Member shall not be allowed to change it subsequently. Any person, who acquires shares of the Company and becomes Member of the Company after the Company sends the Notice of the AGM by Email, and holds shares as on the cut-off date i.e., Tuesday, 2nd August, 2022, are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and password for casting the vote. Members attending the AGM who have not casted their vote by remote e-voting shall be eligible to cast their vote through e-voting during the AGM. Members who have voted through remote e-voting shall be eligible to attend the AGM, however they shall not be eligible to vote at the meeting.
- c) The detailed instructions to cast votes through remote e-voting and through e-voting system during the AGM are mentioned in the Notice and can also be downloaded from www.evotingindia.com.
- d) The Board of Directors have appointed CS Ashok Daga of Ashok Daga & Associates, Practicing Company Secretaries as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent
- e) In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited (CDSL), A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533.

Further, pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Wednesday, 3rd August, 2022 to Tuesday, 9th August, 2022 (both days inclusive) for taking record of the Members of the Company for the purpose of

The Company has fixed Tuesday, 2nd August, 2022, as the "Record Date" for determining eligibility of Members entitled to receive dividend for the financial year ended 31st March, 2022.

Members are requested to carefully read all the Notes set out in the Notice of AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting and e-voting during the AGM.

By Order of the Board For Albert David Limited

Place: Mumbai Date: 15th July, 2022

Chirag A. Vora Company Secretary & Compliance Officer

## **PUBLIC NOTICE**

Notice is hereby given that the Certificate(s) for the under mentioned Equity Shares of the company have been lost / misplaced and the holder(s) / purchaser(s) of the said Equity Shares have applied to the company to issue duplicate Share Certificate(s).

Any person who has a claim in respect of the said Shares should lodge the same with the Company at its Registered Office within 21 days from this date else the Company will proceed to issue duplicate certificate(s) to the aforesaid applicants without any further intimation. Folio no.: R000231; Name of Shareholder: RAJINDER SINGH MALHAR; No of Shares: 1,000; Distinctive No.(s): 404251 To 404750 and 30400002 To 30400501; Certificate No.(s): 2485 and 2752 Name of the Shareholder: RAJINDER SINGH MALHAR

Dated: - 16/07/2022 Name and Registered Office Address of Company: Apollo Tricoat Tubes Limited 37, Hargobind Enclave, Vikas Marg, New Delhi - 110092

**DELHI JAL BOARD : GOVT. OF N.C.T. OF DELHI** OFFICE OF THE CHIEF ENGINEER (DR) PROJ.-III VARUNALAYA BUILDING, PHASE-II, KAROL BAGH, NEW DELHI-110005 e-mail: eecdr15.djb@gmail.com

NIT No. 02 / EE(C)DR-XV (2022-23)

1			` '	_		
	Name of Work	Tender Amount	Tender fees	Earnest Money	Date of release in e-procurement	
	P/L/J Internal & Peripheral sewer lines in Hasanpur GOC under the command of proposed STP at Hasanpur.  2022_DJB_226133_1		Rs. 1500/- Non refundable	Rs. 70,34,723/-	14.07.2022	04.08.2022
	NIT along with all the terms & conditions ISSUED BY P.R.O. (WATER)	is available on Wel	o Site <b>http://delh</b>	i.govtprocure	ement.com.	Sd/-

Advt. No. J.S.V. 237 (2022-23)

Ex. Engineer(C) DR-XV "STOP CORONA: WEAR MASK, FOLLOW PHYSICAL DISTANCING, MAINTAIN HAND HYGIENE'

The Kerala Minerals & Metals Ltd. गजादी क अमृत महोत्साव KMML (A Govt. of Kerala Undertaking) (An ISO 9001, ISO 14001, OHSAS 18001 & SA 8000 Certified Company) Sankaramangalam, Chavara - 691 583, Kollam, Kerala, India Phone: +91-476-2651215 to 2651217. Fax: +91-0476-2680101, 2686721. E-mail: contact@kmml.com, URL:www.kmml.com petitive Tenders are invited for following. For more details please vis E-Tendering Portal, https://etenders.kerala.gov.in or www.kmml.com Excavation of iron oxide from third pond in as is where 1. 2022 KMML 499678 1 is condition and shifting to old ponds in KMML Chavara 15.07.2022 sd/-HOU(TP/TSP) For The Kerala Minerals And Metals Ltd (Satyender Dabas) Our Products:Titanium Dioxide, Titanium Tetra Chloride, Nano Titanium,Titanium Sponge,Rutile, Zircon & Sillima

## zydus Dedicated To Life

## ZYDUS LIFESCIENCES LIMITED

(Formerly known as Cadila Healthcare Limited) [CIN L24230GJ1995PLC025878]

Read. Office: Zvdus Corporate Park, Scheme No. 63, Survey No. 536, Near Vaishnodevi Circle, Khoraj (Gandhinagar), Sarkhej - Gandhinagar Highway, Ahmedabad - 382481, Gujarat, India Telephone : +91-79-71800000, +91-79-48040000 Website : www.zydusife.com E-mail : dhavalsoni@zydusife.com

NOTICE OF 27th (TWENTY SEVENTH) ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND RECORD DATE

- NOTICE is hereby given that the 27" (Twenty Seventh) Annual General Meeting ("AGM") of the Members of Zydus Lifesciences Limited ("the Company") will be held on Wednesday, August 10, 2022 at 10:00 a.m. (IST) through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") ONLY, to transact the businesses as set out in the Notice of the AGM. In accordance with the General Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 8, 2021 and May 5, 2022 ("MCA Circulars for General Meetings"), Securities and Exchange Board of India ("SEBI") circulars dated May 12, 2020, January 15, 2021 and May 13, 2022 ("SEBI Circulars for General Meetings"), the Company has sent the Notice of the AGM along with the Annual Report for the Financial Year ended on March 31, 2022 on Friday, July 15, 2022, through electronic mode only to those members whose e-mail addresses are registered with the Company or Registrar and Share Transfer Agent ("RTA") and Depositories as on Friday, July 8, 2022. The requirement of sending physical copies of the Notice of the
- member who wish to obtain hard copy of Annual Report, may write to the Company for the same. The Annual Report for the Financial Year ended on March 31, 2022 of the Company, inter-alia, containing the Notice and the Explanatory Statement of AGM is available on the website of the Company, Stock Exchanges and Central Depository Services (India) Limited ("CDSL") at www.zyduslife.com, www.bseindia.com, www.nseindia.com and www.evotingindia.com respectively.

AGM has been dispensed with vide MCA Circulars for General Meetings and SEBI Circulars for General Meetings. Any

- Members holding shares either in physical mode or in dematerialized mode, as on Wednesday, August 3, 2022, being the cut-off date, may cast their vote electronically on the businesses as set forth in the Notice of the AGM through electronic voting system ("remote e-voting") of CDSL. All members of the Company are informed that:
  - i. The Ordinary and Special Businesses as set forth in the Notice of the AGM will be transacted only through voting
  - The remote e-voting will commence at 9:00 a.m. (IST) on Sunday, August 7, 2022.
  - The remote e-voting shall end at 5:00 p.m. (IST) on Tuesday, August 9, 2022 and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.
  - The cut-off date for determining the eligibility to vote through remote e-voting or through the e-voting system during the AGM is Wednesday, August 3, 2022.
  - v. E-voting module shall be disabled after 5:00 p.m. (IST) on Tuesday, August 9, 2022.
  - vi. A person who has acquired shares and became a member of the Company after the sending of Notice of AGM by e-mail and holding shares as on cut-off date, may cast vote by following the instructions for e-voting as provided in the Notice convening the AGM, which is available on the website of the Company and CDSL. However, if the person is already registered with any Depository for remote e-voting, then the existing user ID and password can
  - vii. The Members may note that: a) The Members who have cast their vote by remote e-voting prior to the AGM may participate in the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their vote again through e-voting system during the AGM; b) The members participating in the AGM and who had not cast their vote by remote e-voting, shall be entitled to cast their vote through e-voting system during the AGM; c) a person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting, participating in the AGM through VC/ OAVM facility and e-voting during the AGM;
  - viii. For details relating to remote e-voting, please refer to the Notice of the AGM. In case of any queries relating to e-voting, please refer to the Frequently Asked Questions ("FAQs") and e-voting user manual for members available at the download section of www.evotingindia.com or contact at 022-23058542. In case of any grievances connected with facility for e-voting, please contact Mr. Rakesh Dalvi, Manager, CDSL, A Wing, 25" Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai–400013. E-mail: helpdesk.evoting@cdslindia.com.
  - Manoj Hurkat & Associates, Practicing Company Secretaries has been appointed as the Scrutinizer for conducting the remote e-voting and e-voting during the AGM in fair and transparent manner.
  - Members holding shares in physical mode and who have not yet registered / updated their e-mail address are requested to register / update the same with RTA at 506 to 508, Amarnath Business Centre - I, Besides Gala Business Centre, Off C. G. Road, Ellisbridge, Ahmedabad-380006, e-mail id: ahmedabad@linkintime.co.in or to the Company at dhavalsoni@zyduslife.com by sending duly filled and signed Form ISR-1 (along with necessary supporting documents), which is uploaded on website of the Company at https://www.zyduslife.com/public/pdf/Form\_ISR\_1.pdf. Members holding shares in dematerialized mode and who have not yet registered / updated their e-mail address are requested to get their e-mail address registered / updated with their respective DP, by following the procedure of the respective DP.
  - Members holding shares in physical mode and who are yet to register/update their bank account details for electronic receipt of dividend amount directly into their bank accounts, are requested to get the same registered by sending duly filled and signed Form ISR-2, which is uploaded on website of the Company at https://www.zyduslife.com/public/pdf/Form\_ISR\_2.pdf along with self-attested PAN card and Aadhaar card, cancelled cheque and copy of passbook to RTA of the Company at their registered address.
- Members holding shares in dematerialized mode are requested to get their bank account details registered/updated with their respective DP, with whom they maintain their demat accounts.

The record date for the purpose of determining entitlement of members for receiving dividend for the Financial Year For Zydus Lifesciences Limited Sd/- Dhaval N. Soni Company Secretary

Membership No.: FCS7063

FORM NO. NCLT 3A Advertisement detailing petition BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL. KOLKATA BENCH AT KOLKATA C.P. (C.A.A.) No. 79/KB/2022

Connected with C.A. (C.A.A.) No. 201/KB/ 2021 IN THE MATTER OF Companies Act, 2013 And

> IN THE MATTER OF Sections 230 to 232 of the Companies Act, 2013. and other applicable provisions of the Companies Act, 2013.

In the Matter of: The Companies (Compromises, Arrangements and Amalgamations) Rules, 2016 And

In the Matter of: NEW HOLDING AND TRADING COMPANY LIMITED, having Corporate Identification No. U65990WB1981PLC218505 and having its registered office at 8/1B, Diamond Harbour Road, Kolkata -700 027, West Bengal. Transferor Company

In the matter of: INDUSTRIAL AND PRUDENTIAL INVESTMENT COMPANY LIMITED, having Corporate Identification No. L65990WB1913 PLC218486 and having its registered office at 8/1B, Diamond Harbour Road, Kolkata - 700 027, West Bengal.

And

Section 232 of the Companies Act 2013 for the purpose of the passing necessary orders and if thought fit, then in that condition for approving and/or sanctioning with or without modification the Scheme of Amalgamation proposed to be made between New Holding And Trading Company Limited (Transferor Company) and Industrial And Prudential Investment Company Limited (Transferee Company) which was presented by the Advocates for the petitioners on 6th July, 2022 and by the order dated 12th July, 2022 the said petition was admitted, and the said petition is fixed for hearing before the Kolkata Bench of National Company Law Tribunal on 28th July 2022. Any person who is desirous of supporting the said petition or of opposing t, shall send to the petitioners' Advocate, notice of his intention, signed by him or his advocate, with his name and address, so as to reach the petitioners' advocate, not later than 2 (two) days before the date fixed for hearing of the petition. Where he seeks to oppose the petition, the grounds for such opposition or a copy of his affidavit should be furnished with such a notice. A copy of the petition will be furnished by the undersigned to any person requiring the same on payment of the prescribed charges for the same. Dated 15th day of July 2022

Sd/- Debanjan Mandal Fox & Mandal, Advocates 12, Old Post Office Street, Kolkata- 700001 Advocate for the petitioners)

# SINGLE WINDOW SECURITIES LIMITED

1680/31 New No. 994 Ramani's Regency III Floor, Trichy Road. Ramanathapuram, Coimbatore 641 045 INTIMATION OF SURRENDER OF CDSL MEMBERSHIP

- CDSL DP - ID -72600 SINGLE WINDOW SECURITIES LIMITED This is to inform you all concerned that we are proposed to surrender our CDSL Membership. In case of any objection in surrendering our membership, kindly send your written consent with

in 15 days of this advertisement. By Board of Directors of M/s. Single Window Securities Limited.

Date: 16-07-2022 R, Krishnaswamy Place: Coimbatore Managing Director.



Regd.office: 3rd Floor, Maker Chambers IV, 222, Nariman Point, Mumbai - 400 021. Phone: 022-3555 5000. Email: investor.relations@ril.com CIN: L17110MH1973PLC019786

NOTICE

NOTICE is hereby given that the following certificate(s) issued by the Company are stated to have been lost or misplaced and Registered Holders thereof have applied for the issue of duplicate certificate(s).

LIMITED, having Corporate	Folio No.	Name / Joint Names	Shares	Certificate Nos.	Distinctive Nos.
Identification No. L65990WB1913	17/07/25/1000			From - To	From - To
PLC218486 and having its registered office at 8/1B, Diamond	24363970	Anil M Gor	50	50235107-107	1158473773-822
Harbour Road, Kolkata – 700 027.		O.A. C.	50	62444270-270	2206195110-159
West Bengal.			100	66696391-391	6879050123-222
Control Contro	872296	Harshadkumar Acharya	5	439187-187	15932742-746
Transferee Company	177-03333	COLUMN CONTRACTOR OF THE PARTY	3	541431-431	16811747-749
And			52	862691-692	22000835-886
New Holding And Trading			50	1266386-386	36851423-472
Company Limited			8	2118809-809	42128007-014
Industrial And Prudential			10	3052330-330	49100893-902
Investment Company Limited			52	4845853-855	79895661-712
APPLICANTS			70	6288468-469	132904492-561
NOTICE OF PETITION			50	10350867-867	185505177-226
petition under Section 230 read with 3	32596851	Khushma Kishore	40	4194093-094	67091159-198
ection 232 of the Companies Act 2013 for	20100000	Mankermi	18	7363826-826	146163143-160
e purpose of the passing necessary ders and if thought fit, then in that		Kishore Ratansey Mankermi	333	62414310-310	2203298110-442
ondition for approving and/or sanctioning		Rajni Kishore Mankermi			
th or without modification the Scheme of 4	51982193	Mrs Kashiben	40	11060317-317	198142381-420
malgamation proposed to be made		Prahladbhai Patel	40	53341360-361	1248569675-714
etween New Holding And Trading		TO A THE TAKE OF THE PARTY.	18	58428343-343	1623669911-928
ompany Limited (Transferor Company)			98	62344523-523	2195950560-657
nd Industrial And Prudential Investment	F-00/700-4000		196	66583467-467	6867125008-203
ompany Limited (Transferee Company)	7430485	Panna Ravindra Kapadia	50	1301096-096	38795923-972
nich was presented by the Advocates for			20	5279225-225	86731205-224
e petitioners on 6th July, 2022 and by the			32	6581092-092	138171147-178
der dated 12th July, 2022 the said petition			62	11702187-188	213109598-659
is admitted, and the said petition is fixed			50	50219400-400	1157688423-472
hearing before the Kolkata Bench of			100	62383370-370	2199407541-640
	CONTRACTOR OF STATE		200	66632407-407	6871443572-771
tional Company Law Tribunal on 28th	35597492	Sarojni Moondra	40	4599005-006	75189399-438
y 2022. Any person who is desirous of			10	7648161-161	148357873-882
porting the said petition or of opposing			25	14513572-572	388938950-974
shall send to the petitioners' Advocate,			75	53655480-481	1256705710-784
ice of his intention, signed by him or his			150	62211917-917	2185366765-914
vocate, with his name and address, so as			300	66405949-949	6853136288-587
each the petitioners' advocate, not later 7	30443098	Shikha Gupta	40	3883106-107	60871419-458
n 2 (two) days before the date fixed for	COMMUNICATION	STREET, STATE OF STREET,	15	7162670-670	144441774-788
aring of the petition. Where he seeks to			14	12799201-201	257715305-318
pose the petition, the grounds for such			5	14048094-094	330949096-100
position or a copy of his affidavit should			74	53653312-313	1256625372-445
e furnished with such a notice. A copy of			157	62216727-727	2185795323-479
ne petition will be furnished by the		Total	2702		
indersioned to any person requiring the		1	200		

The Public is hereby warned against purchasing or dealing with these securities any way. Any person(s) who has / have any claim in regard of the securities, should lodge such claim with the Company's Registrars and Transfer Agents viz. "KFin Technologies Limited". Selenium Tower B, Plot No. 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032, within Seven (7) days from the date of publication of this notice, failing which, the Company will proceed to issue letter(s) of confirmation in lieu of duplicate certificate(s) in respect of the aforesaid securities.

for Reliance Industries Limited Savithri Parekh Place : Mumbai Date : July 15, 2022 Company Secretary and Compliance Officer www.ril.com



Place: Ahmedabad

Date: July 15, 2022

#### PC Jeweller Limited Regd, Off.: C-54, Preet Vihar, Vikas Marg, Delhi-110092 Phone: 011-49714971. Website: www.pcjeweller.com Fax: 011-49714972, E-Mail: investors@pcjeweller.com Corporate Identity Number: L36911DL2005PLC134929

NOTICE TO THE SHAREHOLDERS Transfer of equity shares of the Company to Investor

**Education and Protection Fund** 

ended on March 31, 2022 is Friday, July 29, 2022.

Notice is hereby given that pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("IEPF Rules"), equity shares of the Company in respect of which dividend has remained unpaid / unclaimed for seven consecutive years or more are required to be transferred by the Company to the demat account of Investor Education and Protection Fund Authority ("IEPF").

In accordance with IEPF Rules, the Company has sent communication at the latest available address of those shareholders, whose shares are liable to be transferred to IEPF. The details of such shareholders have also been uploaded on the website of the Company at www.pcjeweller.com under Investor section.

In case the Company does not receive any communication from the concerned shareholders latest by October 18, 2022, the Company shall with a view to comply with the requirements set out in IEPF Rules, transfer the shares as per the procedure stipulated in IEPF Rules without giving any further notice to the shareholders. All future benefits including dividend on such transferred shares would also be credited

The shareholders are requested to claim their unpaid final dividend for financial year 2014-15 and subsequent dividends before the same are transferred to IEPF. Kindly note that unpaid / unclaimed dividends for financial years prior to 2014-15 have already been transferred to IEPF. Also note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amounts and shares transferred to IEPF pursuant to IEPF Rules. Shareholders may note that unclaimed dividends and shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, can be claimed by them from IEPF Authority after following the procedure prescribed under IEPF Rules.

In case the shareholders have any queries on the subject matter, they may contact the Company's Registrar and Transfer Agent - KFin Technologies Limited, Selenium Tower B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally Mandal, Hyderabad-500032 (Telangana), E-mail: einward.ris@kfintech.com and Toll Free No.: 1800-309-4001.

Date: July 15, 2022


Place: Delhi

For **PC Jeweller Limited** (VIJAY PANWAR)

**Company Secretary** 

Place: Ahmedabad

Date:15.07.2022



## THE ANUP ENGINEERING LIMITED

CIN: L29306GJ2017PLC099085 Regd. Office: Behind 66 KV Elec. Sub-Station, Odhav Road, Ahmedabad – 382 415 Tel. No.: +91-79-2287 2823 Fax No.: +91-79-2287 0642

Email: investorconnect@anupengg.com Website: www.anupengg.com NOTICE OF THE 5<sup>TH</sup>ANNUAL GENERAL MEETING AND E - VOTING INFORMATION

NOTICE is hereby given that the 5<sup>th</sup> Annual General meeting ("AGM") of the members of the Company will be held on Monday, 8<sup>th</sup> August, 2022 at 11:00 a.m. (IST) through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") in compliance with the General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 19/2021, 21/2021 and 02/2022 dated 8<sup>th</sup> April 2020, 13<sup>th</sup> April 2020, 5<sup>th</sup> May 2020, 13<sup>th</sup> January 2021, 8<sup>th</sup> December 2021, 14<sup>th</sup> December 2021 and 5<sup>th</sup> May 2022, respectively, ("MCA Circulars") and Securities and Exchange Board of India vide its circular dated 13<sup>th</sup> May 2022 read with 12th May, 2020 and 15<sup>th</sup> January 2021 ("SEBI Circular"), to transact the business as set out in the Notice of AGM.

In compliance with the above circulars, the company has sent the Notice of the AGM along with the link of the Annual Report for the Financial Year 2021-22 on 15<sup>th</sup> July 2022 through electronic mode only to those Members whose email addresses are registered with the Company/Registrars and Transfer Agent/Depositories. The Notice of the AGM and Annual Report is available on the website of the Company at www.anupengg.com, websites of stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of NSDL at https://www.evoting.nsdl.com.

NOTICE IS FURTHER GIVEN pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations') that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Tuesday, 2<sup>nd</sup> August 2022 till Monday, 8<sup>th</sup> August 2022 (both days inclusive) for the purpose of AGM and to determine the members entitlement for the payment of final dividend for the financial year 2021-22. The final dividend if declared at the AGM will be paid / dispatched subject to deduction of tax at source (TDS) to those members, whose names appear in the Register of Members and/or Register of Beneficial Owners maintained by the Depositories as at the close of business hours on Monday, 1st August 2022.

Pursuant to the changes introduced by the Finance Act 2020, w.e.f. April 1, 2020, the Company would be required to deduct tax at source (TDS) at the prescribed rates on the dividend paid to its shareholders. The TDS rate would vary depending on the residential status of the shareholder and the documents submitted by them and accepted by the Company. Accordingly, the above referred Final Dividend will be paid after deducting the TDS. For the detailed process, the information is available on the Company's website at https://www.anupengg.com/dividend/.

In compliance with Section 108 of the Companies Act, 2013 ('the Act') read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Secretarial Standards -2 issued by the Institute of Company Secretaries of India on General Meetings and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements Regulations) 2015, The Company is providing the facility of remote e-Voting as well as e-Voting during the AGM to all the members to cast their vote electronically on all the resolutions as set out in the Notice of the AGM. The Company has engaged the services of National Securities Depository Limited ('NSDL'), for providing the e-Voting facility to the Members. Facility for e-Voting during the AGM will be made available to those Members who attend the AGM and have not already casted their vote through remote e-Voting. The Members who have cast their vote by remote e-Voting prior to the AGM may also attend / participate inthe AGM through VC / OAVM but shall not be entitled to cast their vote again. The details of e-Voting and the process of e-Voting will be provided in the Notice of the AGM.

The remote e-Voting period will commence at 09:00 A.M. (IST) on Friday, 5<sup>th</sup> August 2022 and will end at 05:00 P.M. (IST) on Sunday, 7<sup>th</sup> August 2022. The remote e-Voting module shall be disabled by NSDL for voting thereafter.

The cut-off date for determining eligibility of members through remote e-Voting and voting at the AGM is Monday, 1<sup>st</sup> August 2022. Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holds shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in mentioning their demat account number/folio number, PAN, name and registered address. The procedure for electronic voting is available in the Notice of AGM as well as in the mail sent to Members by NSDL. Please refer e-Voting user manual for

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-Voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in. Shareholders, who need assistance before or during the AGM, can contact NSDL official Ms. Sarita Mote on Toll free no.: 1800 1020 990 and 1800224430 or send a request at evoting@nsdl.co.in.

Shareholders available in the download section at https://www.evoting.nsdl.com.

By order of the Board For The Anup Engineering Limited

**Chintankumar Patel** Company Secretary



financialexp.epapr.in

# સરકારી કેન્દ્રોમાં ૧૮-૫૯ વરસના વય જૂથના લોકોને ફ્રી બુસ્ટર ડોઝ

પીટીઆઇ નવી દિલ્હી, તા. ૧૫

એપેન્ડિક્સ- IV-A

કરવામાં આવેલા ૭૫ દિવસના આરોગ્ય મંત્રાલય દ્વારા શરૂ ડોઝ મેળવી શકશે.

ધરાવનારા યોજાયો છે. યોગ્યતા વિશેષ કાર્યક્રમ અંતર્ગત લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ૧૮ વર્ષ અને એથી વધુ સરકારી રસીકરણ કેન્દ્રોમાં આપવાનો હેતુ ધરાવતો આ મનસુખ માંડવિયાએ શુક્રવારે સાંપડ્યો હતો અને કેમ્પમાં વર્ષના વયજૂથના ૭૭.૧૦ ૧૬.૮૦ કરોડ કરતાં વધુ હતું. ભારતની મોટાભાગની વયનાં લોકો શુક્રવારથી કેન્દ્રીય કોરોનાની રસીનો મફત બૂસ્ટર કાર્યક્રમ સરરકારના આઝઆદી નિર્માણ ભવન રસીકરણ કેમ્પ અધિકારીઓ તથા સ્ટાફના કરોડની લક્ષિત વસ્તીમાંથી લોકોમાંથી ૨૫.૮૪ટકા લોકો વસ્તીએ નવ મહિના પહેલાં કા અમૃત મહોત્સવના ભાગરૂપે ખાતે કોવિડ રસીકરણ અમૃત સભ્યો બુસ્ટર ડોઝ મેળવવા એક ટકા કરતાં ઓછા લોકોએ તથા હેલ્થકેર અને ફ્રન્ટલાઇન બીજો ડોઝ લઇ લીધો હતો.

મહોત્સવ શરૂ કર્યો હતો. માટે કતારમાં ઊભા રહ્યા હતા. બૂસ્ટર ડોઝ લીધો છએ. જોકે, વર્કર્સે બૂસ્ટર ડોઝ લીધો છે, આ કેમ્પને સારો પ્રતિસાદ અતયાર સુધીમાં ૧૮-૫૯ ૬૦ વર્ષ અને એથી વધુ વયના એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું

 $\Lambda$ nup

# સ્ટેસે**ક એસેટસ મેનેજમેન્ટ શાખા** : પરમસિદ્ધિ કોમ્પલેસ, બીજો માળ, વી.એસ, ઠોસ્પિટલની સામે, એલિસબીજ, અમદાવાદ - ૩૮૦૦૦૬.

વેચાણ નોટિસ ફોન : ove-રકપ૮૦૫૯૪, ફેક્સ - ove-રકપ૮૧૧૩૫, ઇમેઇલ : team2samb.ahm@sbi.co.in, sbi.04199@sbi.co.in

#### અધિકૃત અધિકારીનું નામ : શ્રી નિરજ વાઘેલા, મોબાઈલ : 7600042606,7600042587

#### સ્થાવર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટિસ

[જુઓ નિચમ ૮(૬) ની જોગવાઈ]

**દ્ય-**હકાજી

ધી સિક્ચોરિટાઇગેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ને ધ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮(૬) ની જોગવાઈ સાથે વંચાણે લેતાં હેઠળ સ્થાવર અસ્ક્ર્યામતોના વેચાણની ઈ-હરાજી વેચાણ નોટિસ આથી, અત્રે જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેશદાર (રો) અને જામીનદાર (રો)ને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્શવેલ જગમ/સ્થાવર મિલકત સિક્યોર્ડ લેણદાર પાસે ચાર્જમા/ગિરવે મૂકેલ છે

એનો ફિઝિક્લ કબબે સ્ટેટ બેંક ઓફ ઇંડિયા, સિક્યોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ લીધો છે, સિક્યોર્ડ લેણદાર મિલકતનું 'જેમ છે જ્યાં છે', 'જે કંઈ છે તે છે' અને 'જે કાંઈ છે તે ત્યાં છે' ના આધારે રા ૩૨,૬૦,૫૦,૪૦૬.૦૫ તા. ૩૦.૦૪.૨૦૨૧ સુધીના અને એસબીઆઈને થયેલા અને થત્તાર વ્યાજ, ખર્ચા અને કોસ્ટસ સાથેની રકમની વસલાત માટે ૦૨.૦૮.૨૦૨૨ ના રોજ વેચાણ થશે. આ રકમની ચક્રવણી માટે તા. ૦૪.૦૬.૨૦૨૧ ની ડિમાન્ડ નોટિસ મોકલેલ. સિક્યોર્ડ લેણદારની વસુલાત બાદ કરતાં બાકીની રકમ જે મેસર્સ વૃંદાવન સિરામીક પ્રાઇવેટ લિમેટેક (કરજદાર) અને ૧. જયંતિભાઈ નાગરભાઈ પટેલ, ૨. શ્રી જયંતિભાઈ પ્રાગજીભાઈ ભોરાણીયા (પટેલ), ૩. શ્રી પ્રવિણકુમાર ચંદુલાલ પટેલ, ૪. સ્વ. શ્રી ઓઢવજીભાઈ તેલસીભાઈ ભોરાણીયા, ૫. શ્રી રમેશભાઈ રપુભાઈ, ૬. શ્રી માવજીભાઈ એન. પટેલ, ७. શ્રી બાબુલાલ ખીમજીભાઈ પટેલ, ૮. શ્રી વિદ્વલદાસ એમ. પટેલે, ૯. સ્વે. શ્રી પ્રાગજીભાઈ ટી. ભોરાહીંચા, ૧૦. શ્રી નારાયણભાઈ એન. પટેલ, ૧૧. શ્રી ભગવાનભાઈ તલસીભાઈ ભોરાણીચા, ૧૨. શ્રી દામજીભાઈ ટી. ભોરાણીયા (પટેલ) પાસેથી લેણી રકમ નીકળે છે.

જાહેર હરાજીના તારીખ અને સમયઃ ૦૨.૦૮.૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી દર વખતે અસીમિત ૧૦ મિનિટના એક્સ્ટેન્શન સાથે

,	મિલકત આઈડી નંબર	મિલકતની વિગતો	રીઝર્વ કિંમત (રૂ.)	અર્નેસ્ટ મની કીપોઝીટ (રૂ.)	બીડ વધારવાની રક્ય (રૂ.)	કબજા નો પ્રકાર	નિરીક્ષણની તારીખ અને સમય
	SBIN 62870003	ઈન્ડસ્ટ્રીચલ જમીન, ઈન્ડસ્ટ્રીચલ પ્લોટ, સર્વે નં. ૧૨૬(પી), વ્રજ સિરામીક અને ગોકુલ સિરામીક ની વચ્ચે, ૮–એ નો રેવેન્ચુ સર્વે નં. ૧૨૭ પાછળ, નેશનલ હાઈવે, ધુવા, તાલુકા વાંકાનેર, જીહોર મોરબી, ક્ષેત્રફળ ૧૦૯૯૮ રકે. મીટર્સ ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે જે શ્રી રમેશભાઈ ટપુભાઈ ભોરાણીયા, નારણભાઈ નાગરભાઈ પટેલ, વિદ્વલદાસ મનજીભાઈ પટેલ, સ્વ. પાગજીભાઈ તલસીભાઈ ભોરાણીયા અને મવજીભાઈ નાગરભાઈ પટેલ ની માલીકી.		24,70,000/-	1,00,000/-	Physical	25.07.2022 11:00 am to 01:00 pm
	SBIN 62870005	ઈન્ડસ્ટ્રીચલ જમીન, ઈન્ડસ્ટ્રીચલ પ્લોટ, સર્વે નં. ૧૨७(પી), ૮–એ, નેશનલ હાઈવે, સુનબીમ સિરામીક સામે, ગામ ધુવા, તાલુકા વાંકાનેર, જીહ્યોઃ મોરબી, ક્ષેત્રફળ ૩૧૪૨.૪૪ સ્કે. મીટર્સ ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે જે શ્રી મવજીભાઈ નાગરભાઈ પટેલ અને રમેશભાઈ ટપુભાઈભોરાણીચાની માલીકી.		7,10,000/-	1,00,000/-	Physical	25.07.2022 11:00 am to 01:00 pm

કરભારણઃ અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી અને માહિતી મુજબ, મિલકતો પર કોઈ બોજો નથી. ઇચ્છુક બીડરો બીડ જમા કરાવતા પહેલા પોતાની સ્વતંત્ર રીતે કરભારણ, હરાજીમાં મુકેલ મિલકતના ટાઇટલ, મિલકતને અસર કરતા દાવાઓ /અધિકારો /લેણા અગે પછપરછ કરાવી શકે છે. ઈ-હરાજી જાહેરખબર બેંકની કોઈ પ્રતિબદ્ધતા દર્શાવતી નથી કે કોઈ રજઆત કરતી નથી કે કરશે નહીં મિલકતનું તેના તમામ વર્તમાન અને ભાવિ કરભારણ કે જે બેંક માટે અજાણ્યા હોય તે તમામ સાથે વેચાણ થશે. અધિકૃત અધિકારી /સિક્યોર્ડ લેણદારો થર્ડ પાર્ટી દાવાઓ /અધિકારો /લેણા અંગે કોઈ પણ રીતે

જો હરાજી સરફેસી નિયમ ૯(૨) ની જોગવાઈ મુજબ અનામત કિંમત કરતાં વધુ ન મેળવે તો વેચાણની પુષ્ટિ ગીરો / લેનારાની સંમતિને આધીન રહેશે.

વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે સ્ટેટ બેંક ઓફ ઇંડિયા, સિક્યોર્ડ લેણદારની વેબસાઇટ www.sbi.co.in અને https://ibapi.in પર આપેલ લિંક જૂઓ અથવા (Mob.No.7600042606 & 7600042587) પર સંપર્ક કરો.

અંગ્રેજી અને ગુજરાતી જાહેરાત વચ્ચે કોઈપણ અસમાનતા હશે તો તેવા કિસ્સામાં કાયદાકીય બાબતો માટે અંગ્રેજી જાહેરાત માન્ય ગણાશે

તારીખઃ ૧૬.૦૭.૨૦૨૨, સ્થળઃ અમદાવાદ

અધિકૃત અધિકારી, ભારતીચ સ્ટેટ બેંક



#### L&T TECHNOLOGY SERVICES LIMITED

(A subsidiary of Larsen & Toubro Limited) Registered Office: L&T House, N.M. Marg, Ballard Estate, Mumbai - 400 001; Tel: (91 22) 6752 5656; Fax: (91 22) 6752 5893

#### Email: investor@ltts.com, Website: www.ltts.com, Corporate Identity Number: L72900MH2012PLC232169 EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022

								₹ Million	
		Consolidated				Standalone			
Particulars -		Quarter ended		Year ended	Quarter ended			Year ended	
	30-06-2022 (Reviewed)	31-03-2022 Refer note (4)	30-06-2021 (Reviewed)	31-03-2022 (Audited)	30-06-2022 (Reviewed)	31-03-2022 Refer note (4)	30-06-2021 (Reviewed)	31-03-2022 (Audited)	
Total Income	19,185	17,980	15,626	67,221	16,945	15,900	14,176	60,274	
Net profit before tax	3,774	3,588	2,957	13,092	3,592	3,318	2,834	12,508	
Net profit after tax	2,750	2,632	2,170	9,606	2,625	2,419	2,086	9,185	
Total comprehensive income	2,257	2,646	2,265	10,506	2,025	2,381	2,140	9,991	
Equity share capital	211	211	210	211	211	211	210	211	
Other equity				41,414				39,605	
Face value per equity share (₹)	2	2	2	2	2	2	2	2	
Earnings per equity share (Not annualised)									
(a) Basic EPS (₹)	25.98	24.83	20.57	90.92	24.88	22.93	19.86	87.26	
(b) Diluted EPS (₹)	25.95	24.78	20.44	90.74	24.85	22.88	19.73	87.08	

Place: Mumbai

Date : July 15, 2022

- 1 The financial results of the Company for the quarter ended June 30, 2022 have been subjected to limited review by the statutory auditors, reviewed by the Audit Committee of the Board and approved by the Board of Directors at its meeting held on July 15, 2022.
- 2 The above is an extract of the detailed format of the financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The quarterly financial results in the detailed format are available on the websites of BSE and NSE at www.bseindia.com and www.nseindia.com respectively and on the Company's website at www.ltts.com
- 3 During the quarter ended June 30, 2022, the Company has allotted 21,295 equity shares of ₹2 each fully paid-up on exercise of stock options by employees, in accordance with the Company's stock ontion scheme
- 4 The figures for the quarter ended March 31, 2022 are the balancing figures between audited figures in respect of the full financial year ended March 31, 2022 and the limited
- reviewed year to date figures up to the quarters ended December 31, 2021. 5 Figures for the earlier periods have been regrouped, wherever necessary.

For L&T Technology Services Limited

Chief Executive Officer and Managing Director

Amit Chadha

**OBEROI REALTY LIMITED** 

OBERO REALTY

Registered Office: Commerz, 3rd Floor, Int rnational Business Park, Oberoi Garden City, Goregaon (E), Mumbai – 400 063, India CIN: L45200MH1998PLC114818. E-mail ID: corporate@oberoirealty.com. Website: www.oberoirealty.com Tel: +9122 6677 3333, Fax: +91 22 6677 3334

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022

(Rs. in Lakh, exc					
Particulars		Quarter ended		Year ended	
	30/06/2022	31/03/2022	30/06/2021	31/03/2022	
	Unaudited	Audited (Refer note 2)	Unaudited	Audited	
Revenue from Operations	91,311	82,346	28,425	2,69,397	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	47,149	32,998	10,796	1,11,398	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	47,149	32,998	10,796	1,11,398	
Net Profit / (Loss) for the period after tax and Share of Profit / (Loss) of joint ventures (net) (after Exceptional and / or Extraordinary items)	40,308	23,235	8,063	1,04,710	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	40,348	23,278	8,081	1,04,787	
Paid up Equity Share Capital	36,360	36,360	36,360	36,360	
Other equity (excluding revaluation reserve and securities premium account)				7,21,931	
Securities Premium Account				2,83,323	
Net worth	10,81,940	10,41,614	9,44,974	10,41,614	
	2,82,354	2,85,547	1,64,524	2,85,547	
Earnings Per Share (EPS)* (Face value of Rs.10 each)  1. Basic  2. Diluted	11.09 11.09	6.39 6.39	2.22 2.22	28.80 28.80	
Capital redemption reserve	5,710	5,710	5,710	5,710	
Debentures redemption reserve	-	-	-	-	
Debt equity ratio	0.26	0.27	0.17	0.27	
Debt service coverage ratio	1.75	0.89		0.56	
	Revenue from Operations  Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)  Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)  Net Profit / (Loss) for the period after tax and Share of Profit / (Loss) of joint ventures (net) (after Exceptional and / or Extraordinary items)  Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]  Paid up Equity Share Capital Other equity (excluding revaluation reserve and securities premium account)  Securities Premium Account  Net worth Paid up Debt Capital / Outstanding Debt  Earnings Per Share (EPS)* (Face value of Rs.10 each)  1. Basic 2. Diluted Capital redemption reserve Debentures redemption reserve	Revenue from Operations   91,311     Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)   47,149     Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)   47,149     Net Profit / (Loss) for the period after tax and Share of Profit / (Loss) of joint ventures (net) (after Exceptional and / or Extraordinary items)   40,308     Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]   40,348     Paid up Equity Share Capital   36,360     Other equity (excluding revaluation reserve and securities premium account)     Securities Premium Account   10,81,940     Paid up Debt Capital / Outstanding Debt   2,82,354     Earnings Per Share (EPS)* (Face value of Rs.10 each)   11.09     1. Basic   11.09   11.09     2. Diluted   5,710     Debentures redemption reserve   5,710     Debentures redemption reserve   - 5,720     Debet equity ratio   0.26	Revenue from Operations   91,311   82,346     Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)   47,149   32,998     Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)   47,149   32,998     Net Profit / (Loss) for the period after tax and Share of Profit / (Loss) for the period after tax and Share of Profit / (Loss) for the period after tax and Share of Profit / (Loss) for the period (after Exceptional and / or Extraordinary items)   40,308   23,235     Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)   40,348   23,278     Paid up Equity Share Capital   36,360   36,360     Other equity (excluding revaluation reserve and securities premium account)     Securities Premium Account   10,81,940   10,41,614     Paid up Debt Capital / Outstanding Debt   2,82,354   2,85,547     Earnings Per Share (EPS)* (Face value of Rs.10 each)   11.09   6.39     2. Diluted   11.09   6.39     Capital redemption reserve   5,710   5,710     Debentures redemption reserve   -	Revenue from Operations   91,311   82,346   28,425     Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)   47,149   32,998   10,796     Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)   47,149   32,998   10,796     Net Profit / (Loss) for the period after tax and Share of Profit / (Loss) of joint ventures (net) (after Exceptional and / or Extraordinary items)   40,308   23,235   8,063     Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]   40,348   23,278   8,081     Paid up Equity Share Capital   36,360   36,360   36,360     Other equity (excluding revaluation reserve and securities premium account)   500   500     Securities Premium Account   10,81,940   10,41,614   9,44,974     Paid up Debt Capital / Outstanding Debt   2,82,354   2,85,547   1,64,524     Earnings Per Share (EPS)* (Face value of Rs.10 each)   11.09   6.39   2,22     2, Diluted   11.09   6.39   2,22     Capital redemption reserve   5,710   5,710   5,710     Debentures redemption reserve	

16 Interest service coverage ratio Not annualised, except year end Basic and Diluted EPS

Mumbai, July 15, 2022

- 1. The above is an extract of the detailed format of unaudited Consolidated Financial Results of the Company for the quarter ended June 30, 2022 filed with the stock exchanges under regulation 33 and 52 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as modified ("SEBI LODR"). The full format of the unaudited Consolidated and Standalone Financial Results of the Company for the quarter ended June 30, 2022 are available on the Company's website at www.oberoirealty.com and also on the stock exchange websites i.e., on BSE Limited at www.bseindia.com and on The National Stock Exchange of India Limited at www.nseindia.com.
- ures for the quarter ended March 31, 2022 are the balancing figures between audited figures in respect of full financial year and unaudited published year to date figures up to
- 3. For the other line items referred in Regulation 52(4) of the SEBI LODR, pertinent disclosures have been made to the above stock exchanges and can be accessed on their websites
- 4. The Company has opted to report consolidated financial results pursuant to regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The standalone financial results are summarised below (Rs. in Lakh **Particulars**

30/06/2022 31/03/2022 30/06/2021 31/03/2022 (Refer note: 40.365 1.07.48 Total revenue (including other income) 25.808 11.06 25,813 5,94 49,85 7,28 Profit after tax 19.67 4.619 38,18 For and on behalf of the Board Vikas Obero

# ધ અનુપ એન્જીનિચરીંગ લીમીટેડ CIN: L29306GJ2017PLC099085

**૨૪૪૨ર્ડ ઓફીસ:** દૃદ્ કેવી ઇલેક્ટ્રીક સબ-સ્ટેશન પાછળ, ઓઢવ રોડ, અમદાવાદ-૩૮૨ ૪૧૫ **ફોન** : +૯૧-૭૯-૨૨૮૭ ૨૮૨૩, <del>ફેક્સ</del> : +૯૧-૭૯-૨૨૮૭ ૦૬૪૨,

#### પાંચમી વાર્ષિક સામાન્ય સભા અને ઇ-વોટીંગની માહિતીની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની પાંચમી વાર્ષિક સામાન્ય સભા (''એજીએમ'') **સોમવાર, ૮ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે** કોર્પોરેટ અફેર્સ મંત્રાલ દ્વારા જારી કરાયેલા જાહેર પરિષત્ર નં. ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧, ૧૯/૨૦૨૧, ૨૧/૨૦૨૧ અનુક્રમે તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦, પ મે, ૨૦૨૦, ૧૩ જાન્યુઆરી ૨૦૨૧, ૮ ડિસેમ્બર, ૨૦૨૧, ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ અને પ મે, ૨૦૨૨ (''એમસીએ પરિપત્રો") અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ તેના પરિપત્ર તારીખ ૧૩ મે, ૨૦૨૨ સાથે વંચાતા ૧૨ મે, ૨૦૨૦ અને ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ (''સેબી પરિપત્ર") અંતર્ગત એજીએમની નોટીસમાં દર્શાવેલા વ્યવહારો કરવા માટે યોજાશે

ઉપરોક્ત પરિપત્રો અંતર્ગત કંપનીએ એજીએમ નોટીસ તેમજ નાણાંકિય વર્ષ ૨૦૨૧–૨૨ નો વાર્ષિક અહેવાલ (એન્યુઅલ રીપોર્ટ) કંપની/ રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ/ડિપોઝીટરીઓ પાસે જે સભ્યોના ઇમેઇલ એડેસ રજીસ્ટર્ડ છે તેમને કક્ત ઇલેક્ટોનિક માધ્યમથી તારીખ ૧૫ જલાઇ. ૨૦૨૨ નાં રોજ મોકલવામાં આવ્યા છે અને એજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ <u>www.anupengg.com,</u> પર તેમજ સ્ટોક એક્સચેન્જ જેવા કે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટ અનુક્રમે <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> અને એનએસઙીએલની વેબસાઇટ <u>https://www.evoting.nsdl.com</u> પર પણ ઉપલબ્ધ રહેશે.

કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૯૧ ની જોગવાઇઓ તથા કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૦ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ (સેબી લિસ્ટીંગ રેગ્યુલેશન્સ) ના નિયમન ૪૨ મુજબ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ **મંગળવાર, ૨ ઓગસ્ટ, ૨૦૨૨ થી સોમવાર,** ૮ **ઓગસ્ટ, ૨૦૨૨** સુધી (બંને દિવસો સહીત) એજીએમના હેતુસર અને નાણાંકિય વર્ષ, ૨૦૨૧-૨૨ ના અંતિમ ડિવિડન્ડની ચુકવણી માટે હકદાર સભ્યો નક્કી કરવા માટે બંધ રહેશે. અંતિમ ડિવિડન્ડ, જો એજીએમમાં જારી કરવામાં આવશે તો જે સભ્યોના નામ **સોમવાર, ૧ ઓગસ્ટ, ૨૦૨૨** ના ચાલુ કામકાજના કલાકો પુરા થતાં રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને / અથવા ડિપોઝીટરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં હાજર છે તે સભ્યોને જરૂરી વેરો કાપ્યા પછી ચુકવવામાં / રવાના કરવામાં આવશે.

૧ એપ્રિલ. ૨૦૨૦ થી લાગ પડતા નાર્લાકિય કાયદા ૨૦૨૦ ના નવા કેરકારો મજબ. કંપનીએ તેના શેરહોલ્ડરોને ચકવાયેલ ડિવિડન્ડ પર જણાવેલ દરોએ વેરો (ટીડીએસ) કાપવો આવશ્યક રહેશે. જે મુજબ ટીડીએસ દરો શેરહોલ્ડરોના રેસીડેન્સીયલ સ્ટેટસ અને તેમના દ્વારા આપેલા અને કંપની દ્વારા સ્વીકારાયેલ દસ્તાવેજોને આધિન રહેશે. તદઅનુસાર, ઉપર દર્શાવેલ અંતિમ ડિવિડન્ડ ટીડીએસ કાપ્યા પછી ચુકવવામાં આવશે. વિગતવાર પ્રક્રિયા અને જરૂરી માહિતી કંપનીની વેબસાઇટ <u>https://www.anupengg.com/dividend</u> પર ઉપલબ્ધ છે.

સમયાનુસાર કરાયેલ સુધારાઓ મુજબ કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો,૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વંચાતી કંપની કાયદા,૨૦૧૩ (એક્ટ) ની કલમ ૧૦૮, સામાન્ય સભાઓ માટે ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડસ- ૨ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૪ ના અનુપાલન હેઠળ, કંપની એજીએમની નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિક માધ્યમથી મત આપવા માટે બધા સભ્યોને રીમોટ ઇ-વોટીંગ તેમજ એજીએમ દરમિયાન ઇ-વોટીંગની સવલત પુરી પાડવામાં આવશે. કંપનીએ સભ્યોને ઇ-વોટીંગની સવલત આપવા માટે નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ ('એનએસડીએલ') ની નિમણુક કરેલ છે. એજીએમ દરમિયાન ઇ-વોટીંગની સુવિધા એજીએમમાં હાજર રહેનાર અને રીમોટ ઇ-વોટીંગથી અગાઉ તેમનો મત આપ્યો નથી તેવા સભ્યોને ઉપલબ્ધ કરાવામાં આવશે. જે સભ્યોએ એજીએમ પહેલા રીમોટ ઇ-વોટીંગથી તેમના મત આપ્યા છે તેઓ એજીએમમાં હાજર રહી શકે છે / ભાગ લઇ શકે છે, પરંતુ ફરીથી તેઓ મત આપવા હકદાર ગણાશે નહી. ઇ-વોટીંગની વિગતો અને ઇ-વોટીંગની પ્રક્રિયા એજીએમની નોટીસમાં આપવામાં આવેલ છે.

રીમોટ ઇ-વોટીંગનો સમયગાળો શ્ક્રવાર, પ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ (સવારે ૯ઃ૦૦ ક્લાકે) શરૂ થશે અને રવિવાર, ૭ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ (સાંજે પઃ૦૦ ક્લાકે) પૂર્ણ થશે. ત્યારબાદ રીમોટ ઇ-વોટીંગ મોડ્યુલ વોટીંગ માટે એનએસડીએલ દ્વારા બંધ કરવામાં આવશે.

રીમોટ ઇ-વોટીંગ અને એજીએમમાં વોટીંગ માટે સભ્યોની લાયકાત નક્કી કરતી **કટ-ઓફ તારીખ સોમવાર, ૧ ઓગસ્ટ, ૨૦૨૨** રાખેલ છે. નોટીસ મોકલ્યા પછી કંપનીના શેરો મેળવનાર અને કંપનીના સભ્ય બનનાર અને કટ-ઓફ તારીખના રોજ શેરો ધરાવતી કોઇપણ વ્યક્તિ <u>evoting@nsdl.co.in</u> પર તેમના ડિમેટ એકાઉન્ટ નંબર/ ફોલિયો નંબર, પૅન, નામ અને રજીસ્ટર્ડ સરનામું જણાવતી અરજી મોકલીને લોગીન આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. ઇલેક્ટ્રોનિક વોટીંગની પ્રક્રિયા એજીએમની નોટીસ તેમજ એનએસડીએલ દ્વારા સભ્યોને મોકલાયેલ મેઇલમાં આપેલ છે. વધારાની માહિતી માટે <u>https://www.evoting.nsdl.com</u> પર ડાઉનલોડ સેક્શનમાં ઉપલબ્ધ શેરહોલ્ડરો માટેના ઇ-વોટીંગ યુઝર મેન્યુઅલ જોવા વિનંતી છે.

કોઇપણ પુછપરછના કિસ્સામાં, તમે <u>www.evotinq.nsdl.com</u> ના ડાઇનલોડ સેક્શનમાં ઉપલબ્ધ શેરહોલ્ડરોના વાંરવાર પુછાતા પ્રશ્નો (એફએક્યુએસ) અથવા શેરહોલ્ડરો માટેના ઇ–વોટીંગ યુઝર મેન્યુઅલ જોઇ શકો છો અથવા ટોલ ફ્રી નં: ૧૮૦૦-૨૨૨-૯૯૦ પર કોલ કરી શકો છો અથવા <u>evoting@nsdl.co.in</u> પર અરજી મોકલી શકો છો. એજીએમ પહેલા અથવા એજીએમ દરમિયાન મદદ ઇચ્છતા સભ્યો એનએસડીએલના અધિકારી શ્રીમતી સરીતા મોટેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ ૫૨ અથવા <u>evoting@nsdl.co.in</u> પર સંપર્ક કરી શકે છે.

સ્થળ: અમદાવાદ તારીખ: ૧૫.૦૭.૨૦૨૨

ભાવસાર

|3. (૧) વાઘેલ

Chairman & Managing Director

જ્યોત્સનાબેન દિપકભાઇ

20-04-2021

/ Rs.1659569/- as on

બોર્ડના હુકમથી દ્ય અનુપ એન્જીનિચરીંગ લીમીટેડ વતી ચિંતનકુમાર પટેલ કંપની સેક્રેટરી

કબજા નોટીસ APPENDIX –IV [Rule 8(1)] **AXIS BANK** રાજપથ કલબ સામે, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત - ૩૮૦ ૦૫૪.

નીચે સહી કરનાર, એક્સિસ બેંક લિ. ના અધિકૃત અધિકારી તરીકે સિક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઑફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (ઉક્ત અધિનિયમ) હેઠ¢ તેમજ સિક્ચરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) એક્ટ, ૨૦૦૨ (ઉક્ત અધિનિચમ) ના સેક્શન ૧૩(૧૨) સાથે નિચમ ૩ વંચાણે લેતાં મળેલ સત્તાની રૂએ નીચે ટેબલમાં જણાવેલ તારીખે કિમાન્ડ નોટીસ જારી કરેલ હતી નીચે ટેબલ જણાવેલ કરજદાર/સફકરજદાર/ગીરવેદાર /જામીનદાર નીચે ટેબલમાં જણાવ્યા મુજબ <mark>બાકી રકમ ઉપરાંત આ રકમ પરનું કોન્ટ્રેકરચુઅલ દરે થતું આગળનું વ્યાજ, થયેલ/થનારા આકસ્મિક ખર્ચા, પડતર, ચાર્જીર</mark> વગેરે સદર નોટીસ ની તારીખથી દિન સાઠ (૬૦) માં ભરપાઈ કરી જવા જણાવેલ.

નીચે ટેબલમાં જણાવેલ કરજદાર/સદકરજદાર/ગીરવેદાર/જામીનદારને સિક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઑફ ફાયનાભાિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ દેઠળ આપેલ નોટીસમાં જણાવેલ બેંકની બાકી રકમની ચૂકવણી કરવામાં કસૂરવાર નીવડયા છે. તેથી અત્રે આ દેણદાર અને નોટીસમાં ઉક્ષેખેલ અન્યોને ખાસ તથા જાહેર જનતાને સામાન્ય રૂપે નોટીસ આપવામાં આવે છે કે નીચે સફી કરનાં તેને ઉપરોક્ત કાયદાના સેક્શન ૧૩(૪) સાથે નિયમે પૈકી નિયમે ૮ વંચાણે લેતા મળેત સત્તાની રૂએ નીચે જણાવેલ તારીખે નીચે વર્ણવેલ મિલકતનો કબજો લીધો છે.

અત્રે નીચે ટેબલમાં ઉક્ષેખ કરેલ કરજદાર/સહકરજદાર/ગીરવેદાર /જામીનદારને વિશેષ રૂપે અને સામાન્ય રીતે જાહેર જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે સદરહુ મિલકત અંગે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહી અને તે રીતે થચેલ કોઈપણ વ્યવહાર તે નોટીસમાં જણાવ્યા મુજબ **એક્સિસ બેંક લિ**. નીચે ટેબલમાં જણાવ્યા મુજબ ની **બાકી રકમ ઉપરાંત આ રકમ પરનું કોન્ટ્રેકચ્યુઅલ દરે થતું આગળનું વ્યાજ, <b>થચેલ ⁄ થનારા આકસ્મિક** 

ખર્ચા, પડતર, ચાર્જીસ વગેરે રકમના બોજા આધીન રહેશે. ગીરવે રાખેલ અસ્કથામતો આપેલા સમયમાં છોડાવવા અંગે કરજદારોનું સરફૈસી એક્ટ, ૨૦૦૨ના સેક્શન ૧૩ના સબ-સેક્શન (૮) ની જોગવાઈ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

631	55&EI5 /	કિમાન્ક નોટીસ તારીખ	મિલકતોની વિગતો	કબજાની
동 하.	કરજદાર / જામીનદાર / સહ-કરજદારના નામ	અને બાકી રકમ (વ્યાજ+ યાર્જીસ -રીકવરી)	અચલિત મિલકતોની વિગતો	વારીખ અને પ્રકાર
1.	(૧) પઠાણ સમીઉદ્યાદખાન અમીનખાન (૨) ફાતમાબાનું સમીઉદ્યાદખાન પઠાણ	19-04-2022 / RS 1399392/-loan no .PCR001301275961 , RS 1107082/- loan no : PCR001302297107, RS 1151576/- loan no :LTR001304236407 as on 13-04-2022	ક્ષેત્રફળ કાર્પેટ એરિયા સથાજીગંજ સીટી એસ આર નં. ૮/૪ અને સીટી એસ આર નં. ૮૨૧ થી ૮૨૮ વડોદરા સીટી આર એસ નં. ૪૬૧/૧ અને ૪૬૪ આકત્રીત્ર નં. ૪૬૪/૧/૧, રહે. મી. ૨૯૩૪.૦૦, "ફોનીક્સ કોમ્પ્લેશ" જેતલપુર બ્રિજ પાસે, બાંધકામ મેપ વડોદરા કોર્પોરેશન નં. એચ બી / એસ–૧૦/વોર્ડ સેક્ચર–૧૪/૯૩–૯૪ એપુડ ૦૯/૧૨/૧૯૯૩ કોનીક્સ કોમ્પ્લેશ, પ્રોપર્ટી પાસે, છઠ્ઠો માળ ઓફિસ નં. ૬૩૨ થી ૬૩૭ મિલકત બાંધકામ ક્ષેત્રફળ ૧૫૮૪.૨૫ રહે. કુટ સુપર બિલ્ટ અપ જેતલપુર બ્રીજ, મોજે સથાજીગંજ જેતલપુર રોઠ, સબ જીદો વડોદરા, જીદો વડોદરા ની જમીન અને બિલ્ડીંગના બધા દક, ટાઇટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ. ચતુરસીમા આ ગુજન છે: ઉત્તરઃ કોમ્પ્લેશનો ખૂદ્દ્યો કોમન પેસેજ, દક્ષિણઃ કોમન પેસેજ, જેતલપુર બ્રીજ બાજુ, પૂર્વઃ ઓફિસ નં. ૬૨૮ થી ૬૩૧, પશ્ચિમઃ ઓફિસ નં. ૬૩૮ થી ૬૪૦.	11-07-202: સાંકેતિક
2.	(૧) રસપાલસિંહ દરજીતસિંહ શીખ (૨) અનીતાબેન રસપાલસિંહ જોહલ	19-04-2022 / Rs 634522 /- as on 13-04-2022	ક્ષેત્રફળ કાર્પેટ એસ આર નં. ૬૪૯/બી, ૬૪૯/એ, ૬૫૯/બી અને હ૧૦ કુલ ક્ષેત્રફળ ૮૫૬૫૫.૦૦ સ્કે. મીટર્સ મોજે જરોદ (ઉપરોક્ત ક્ષેષ્ટમાં સમાવિષ્ઠ વિગતો મુજબ) તેની સ્ક્રીમ ''લુકફીલ્ઝ આઇવેન્ડ'' પ્લોટ નં. ૦૮૫ ફેત્રફળ અંદાજે ૧૬૬–હ૬ સ્કે. મીટર્સ (૧૯૯૫–૦૦ સ્કે. કુટ) અને જમીન રોડ અંતર્ગત / કોમન પ્લોટ ફેત્રફળ ૮૩-૮૨ સ્કે. મીટર્સ (૦૩૦–૦૦ સ્કે. કુટ) કુલ ૧૫૦–૬૫ સ્કે. મીટર્સ (૧૬૯૮– ૦૦) જેની સ્ક્રીમ ટાઇટલ બુકફીલ્ઝ આઇલેન્ડ મોજ ગામ જરોદ, વાઘોડિયા સબ જીક્ષો વડોદરા, વડોદરા ની જમીન અને બિલ્ડીંગના બઘા હક, ટાઇટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ. ચતુરસીમા આ મુજબ છેઃ ઉત્તરઃ ૧૨ મીટર પહોળો રોડ, દક્ષિણઃ પ્લોટ નં. ૧૦૨, પૂર્વઃ પ્લોટ નં. ૮૬, પશ્ચિમઃ ૯.૦૦ મીટર પહોળો રોડ	11-07-202 સાંકેતિક
3.	(૧) બલવીંદર જયરામ ગીરી (૨) રેખાદેવી શ્રીબર્મા ગીરી	16-04-2022 / Rs.374669/- as on 11- 04-2022	ફલેટ નં. ૧૦૪, બિલ્ડીંગ નં. ડી/૩, શીવદ્રષ્ટિ રેસીકન્સી, બિલ્ટ અપ એરિયા ૨૩૨.૬૩ રકે. કૂટ એટલે ૨૧.૬૨ રકે. મીટર્સ કાર્પેટ એરિયા ૨૧૩ રકે. કુટ રફેણાંક રેવેન્યુ સર્વે નં. ૫૯/૨ પારડી કંડે, બ્લોક નં. ૬७, ૨જીસ્ટર્ડ બીનખેતી જમીન કુલ જમીન ક્ષેત્રફળ ૧૪૫૮ રકે. મીટર્સ ટી.પી.એસ. નં. ૫૯ (પારડી કંડે – સચીન – કંચદ) ઓ.પી. નં. ૬૪, એફ.પી. નં. ૬૪ કુલ જમીન ક્ષેત્રફળ ૭૪૫૯ રકે. મીટર્સ પેકી ૬૯૪૧.૪૩ રકે. મીટર્સ રફેણાંક ફેતુ ફાળવેલ અને ૭૦૭.૫૭ ફાન્યા કોમ્યાયિલ ફેતુ મોટે. મોજે ગામઃ પારડી કંડે, સબ જીહોઃ ચૌર્ચારી, જીહોઃ સુરત ગુજરાત રાજ્ય ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે અને ચતુરસીમા આ મુજબ છેઃ ઉત્તરઃ બ્લોક નં. ૭૧ અને ૭૨, દક્ષિણઃ સચીન સીમાડા, પૂર્વઃ બ્લોક નં. ૬૮ અને તળાવ, પશ્ચિમઃ બ્લોક નં. ૬૬	12-07-202: સાંકેતિક
4.	(૧) જીયાની રોનક વિનુભાઈ (૨) દર્ષાબેન રોનકભાઈ જીયાની	16-04-2022 / Rs.798393/- as on 11- 04-2022	ફલેટ નં. ૪૦૧, ટાઈપ એ–૧, ચોથો માળ, બિલ્ટ અપ એરિયા ૪૧૫ સ્કે. કુટ એટલે ૩૮.૫७ રકે. મીટર્સ સુપર બિલ્ટ અપ એરિયા ૬૯૨ રકે. કુટ એટલે ૬૪.૩૧ રકે. મીટર્સ તેનીસાથે અવિભાજીત પાર્કીંગ એરિયા ૨૨.૮૫ રકે. મીટર્સ રેવેન્યુ સર્વે નં. ૩૩૫, બ્લોક નં. ૩૧૫, બિલ્ટ રહેણાંક પ્રોજેક્ટ ''સતનામ એવેન્યુ'' બીનખેતી જમીન ७७.૩૦ રકે. મીટર્સ, મોજે ગામ કામરેજ, સબ જીકો કામરેજ, જીકો સુરત ગુજરાત રાજ્ય બિલ્ડીંગ નં. એ–૧ ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે અને ચતુરસીમા આ મુજબ છેઃ ઉત્તરઃ અન્ય સોસાયટી, દક્ષિણઃ અન્ય સોસાયટી, પૂર્વઃ રોક, પશ્ચિમઃ નવાગામ ગામનો બ્લોક નં. ૧૩૮ અને ૧૩૯ ની જમીન	12-07-2022 સાંકેતિક
5.	(૧) મુકેશ બંસીલાલ બોહરા (૨) શ્રીમતી અલકાબેન મુકેશભાઈ બોહરા	16-04-2022 / Rs.978167/- as on 11- 04-2022	ફલેટ નં. ૪૦૧, ટાઈપ એ–૧, ચોથો માળ, બિલ્ટ અપ એરિયા ૪૧૫ સ્કે. કુટ એટલે ૩૮.૫૭ સ્કે. મીટર્સ, સુપર બિલ્ટ અપ એરિયા ૬૯૨ સ્કે. કુટ એટલે ૬૪.૩૧ સ્કે. મીટર્સ તેનીસાથે અવિભાજીત પાર્કીંગ એરિયા ૨૨.૮૫ સ્કે. મીટર્સ રેવેન્થુ સર્વે નં. ૩૩૫, બ્લોક નં. ૩૧૫, બિલ્ટ રહેણાંક પ્રોજેક્ટ ''સાંતમ એવેન્થુ'' બીનખેતી જમીન ७७.૩૦ સ્કે. મીટર્સ મોજે ગામ કામરેજ, સબ જીકો કામરેજ, જીકો સૂરત ગુજરાત રાજ્ય બિલ્ડીંગ નં. એ–૧ ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે અને ચતુરસીમા આ મુજબ છેઃ ઉત્તરઃ અન્ય સોસાયટી, દક્ષિણઃ અન્ય સોસાયટી, પૂર્વઃ રોડ, પશ્ચિમઃ નવાગામ ગામનો બ્લોક નં. ૧૩૮ અને ૧૩૯ ની જમીન	12-07-202 સાંકેતિક
6.	(૧) ગાંગડીયા રાજેશભાઈ નારાયણભાઈ (૨) ગાંગડીયા કિરણબેન રાજેશભાઈ	16-04-2021 / Rs.1454065/- as on 13-04-2022	કલેટ નં. એલ–૬૦૫, છટ્ટો માળ, બ્લોક નં. – એલ, ''પોલારીસ આનંદ'' તેનું ક્ષેત્રફળ કાર્પેટ એરિયા ૪૬.૪૨ સ્કે. મીટર્સ, તેનીસાથે અવિભાજીત ૨૧.૫૯ સ્કે. મીટર્સ, સર્વે નં. ૧૦૧, ટી.પી. ૧૧૯ (નિકોલ), એફ.પી. નં. ૨૨, મોજેઃ નિકોલ, તાલુકાઃ અસારવા, સબ જીદો અમદાવાદ – ૧૨ (નિકોલ), જીદોઃ અમદાવાદ માં આવેલ જમીન અને બિલ્ડીંગ ના બધા હક, ટાઈટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ. ચતુરસીમાઃ પૂર્વઃ કલેટનો મેઈન દરવાજો કોમન પેસેજ સીડી, પશ્ચિમઃ બિલ્ડીંગ કોમન દિવાલ, ઉત્તરઃ બિલ્ડીંગ કોમન દિવાલ, દક્ષિણઃ ફલેટ નં. એલ–૬૦૪.	13-07-202 સાંકેતિક
7.	(૧) મેસર્સ એમરાલ્ડ કાર પ્રાઇવેટ લિમિટેક, (૨) કાનૈયો એમ. ઠક્કર (૩) ખુશી કાનૈયો ઠક્કર	02-12-2021 / Rs.84,25,995.42/- being the amount due as on 26-11-2021	રહેણાંક ફલેટ નં. ૮૦૧, ક્ષેત્રફળ ૨૧७ રકે. ચાર્ક (સુપર બિલ્ટ અપ એરિયા) આઠમો માળ, ''નિર્મલા શાંતિ ટાવર સ્કીમ–એ'' નામે જાણીતી સ્કીમ, શ્રીશાંતિ ઓનર્સ એસોશીએશન, ફાઈનલ પ્લોટ નં. ૨૧૫/પૈકી, ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૧/એસ, રેવેન્યુ સર્વે નં. 333/પી મોજેઃ બોડકદેવ, તાલુકા ઘાટલોડિયા, જીદ્દોઃ અમદાવાદ ની અચલિત મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે જે કનૈયો મનદરલાલ ઠક્કર ની માલીકી અને ચતુરસીમાઃ ઉત્તરઃ અન્ય મિલકત, દક્ષિણઃ ખૂદ્દો પેસેજ, પૂર્વઃ પેસેજ એરિયા, પશ્ચિમઃ ખૂદ્દી જગ્યા.	12-07-202 સાંકેતિક
8.	(૧) પટેલ નિમિષાબેન મણીલાલ, (૨) દિપકકુમાર બબલદાસ પટેલ	18-04-2021 / Rs.1966565/- as on 19-04-2022	કલેટ નં. બી–30૪, ત્રીજો માળ, બ્લોક નં. ''બી' ''બ્રજધામ–3'' (દ બ્રજધામ કો.ઓપ.દાઉર્સીંગ સોસાયટી લિમિટેડ) તેનું ક્ષેત્રફળ બિલ્ટ અપ એરિયા ૮૯.૪૫ સ્કે. મીટર્સ એટલે ૧૦૭ સ્કે. ચાર્ડ, સર્વે નં. ૧૬૨, ટી.પી.એસ. નં. ૧૮, એફ.પી. નં. ૧૬૮, મોજેઃ ઘાટલોડિયા, તાલુકાઃ સીટી, સબ જીદ્યોઃ અમદાવાદ – ૨ (વાડજ), જીદ્યોઃ અમદાવાદ માં આવેલ જમીન અને બિલ્ડીંગ ના બધા હક, ટાઇટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ. ચતુરસીમાઃ પૂર્વઃ સોસાયટી માર્જીન, પશ્ચિમઃ ફલેટ નં. બી – 303, ઉત્તરઃ સોસાયટી રોડ, દક્ષિણઃ ફલેટ નં. બી–30પ	13-07-202 સાંકેતિક
9.	રાકેશકુમાર વાડીલાલ શાહ	16-04-2021 / Rs.947682/- as on 11- 04-2022	કલેટ નં. એ–૯૦૪, નવમો માળ, બ્લોક નં. ''એ'' ''વાસુકાનંદ કો.ઓપ.ફાઉ.સોસ. લિમિટેક'' તેનું ક્ષેત્રફળ એરિયા ૬૩.૮૬ સ્કે. મીટર્સ, સર્વે નં. ૨૮૫/૨, ટી.પી. નં. ૨, એફ.પી. નં. ૧૮૫, મોજેઃ ઘાટલોડિયા, તાલુકાઃ ઘાટલોડિયા, સબ જીક્ષોઃ અમદાવાદ -૨ (વાડજ), જીક્ષોઃ અમદાવાદ માં આવેલ જમીન અને બિલ્ડીંગ ના બધા હક, ટાઇટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ. યતુરસીમાઃ પૂર્વઃ તેજસ સોસાયટી, પશ્ચિમઃ ફલેટ નં. – ૯૦૧, ઉત્તરઃ મેઈન રોઠ, દક્ષિણઃ ફલેટ નં. ૯૦૩	13-07-202 સાંકેતિક
10.	(૧) રાવળ આનંદભાઈ રાજુભાઈ (૨) સોલંકી કમલેશભાઈ હરીભાઈ	11-04-2021 / Rs.844433/- as on 21- 04-2022	કલેટ નં. ઈ–૫૦૧, પાંચમો માળ, બ્લોક નં. "ઈ" "આકૃતિ ટાઉનશીપ" તેનું ક્ષેત્રફળ બિલ્ટઅપ એરિયા ૭૦ સ્કે. યાર્ડ એટલે પટ.૫૧ સ્કે. મીટર્સ, સર્વે નં. ૭૧/૫/૧, ૭૧/૫/૧ અને ૭૧/૫/૩ ટી.પી. નં. ૫૭, એફ.પી. નં. ૮૧, મોજેઃ નારોલ ગામ, તાલુકાઃ સીટી, સબ જીકોઃ અમદાવાદ – ૫ (નારોલ), જીકોઃ અમદાવાદ ની જમીન અને બિલ્ડીંગ ના બધા હક, ટાઈટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ. યતુરસીમાઃ પૂર્વઃ ૨૫ કુટ રોડ, પક્ષિમઃ ફલેટ નં. ઈ–૫૦૪, ઉત્તરઃ ફલેટ નં. ઈ–૫૦૮, દક્ષિણઃ ફલેટ નં. ઈ–૫૦૨.	13-07-202 સાંકેતિક
11.	(૧) રોનક કિરીટકુમાર શાહ, (૨) સુનિતાબેન કિરીટકુમાર શાહ	20-04-2021 / Rs.1575473/- as on 20-04-2022	કલેટ નં. એમઆઈજી–૧/૪/૧૨૦૨, ''એમઆઈજી–૧ ગોતા'' તેનું ક્ષેત્રફળ એરિયા ७૦૦ રકે. ફુટ મોજે: ગોતા, સબ જીક્ષો અને જીક્ષો: અમદાયાદ ની જમીન અને બિલ્કીંગ ના બધા હક, ટાઇટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ	13-07-202 સાંકેતિક
12.		11-04-2021 / Rs.2135830/- as on 21-04-2022	કલેટ નં. – જે – ૧૦૨, પહેલો માળ, કોમ્પ્લેક્ષ નં. – જે, ''દેવા સમૃદ્ધિ રેસીડન્સી'' તેનો એપ્રોક્ષ એરિયા ૯૯ રકે. યાર્ડ એટલે ૮૨.७૬ રકે. મીટર્સ, સુપર બિલ્ટ અપ એરિયા તેનીસાથે અવિભાજીત ૨૮.૧૨ રકે. ચાર્ડ એટલે ૨૩.૫૧ રકે. મીટર્સ, બ્લોક / સર્વે નં. ૧૧૩૯/૧૬, ટી.પી. ૧૧૩ (વસ્ત્રાલ), એફ.પી. નં. ૧૦७, મોજે વસ્ત્રાલ, સબ તાલુકાઃ વટવા, જીલોઃ અમદાવાદ કિવીઝન – ૧૨, જીલો અમદાવાદ ની	13-07-202 સાંકેતિક

પછી કોમન પેસેજ, દક્ષિણઃ બિલ્કીંગ કોમન દિવાલ, પૂર્વઃ ફલેટ નં. એચ–૫૦૨, પશ્ચિમઃ ફલેટ નં. જી–૫૦૮ મહેરબાની કરીને નોંધ લેશો કે કાયદાના સેક્શન ૧૩ (૧૩) અન્વયે નોટીસ મબ્યેથી બેંક પાસે રાખેલ અસક્યામતો પૈકી એક પણ અંગે તમે વેચાણ, લીઝ કે અન્ય કોઈરીતે વ્યવહાર બેંકની પૂર્વમંજૂરી સિવાય નહી કરી શકો. તારીખઃ ૧૬-૦૭-૨૦૨૨, સ્થળ ઃ ગુજરાત અધિકત અધિકારી. એક્સિસ બેંક લિ.

દક્ષિણઃ માર્જીન, પૂર્વઃ માર્જીન તેના પછી બ્લોક–આઈ , પશ્ચિમઃ ફલેટ નં. જે / ૧૦૩

જમીન અને બિલ્કીંગ ના બધા હક, ટાઈટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ અને ચતુરસીમા આ મુજબ છેઃ ઉત્તરઃ ફલેટ નં. જે/૧૦૧,

ફલેટ નં. – ૫૦७, પાંચમો માળ, કોમ્પ્લેક્ષ નં. – જી, ''દેવમ રેસીકન્સી'' તેનો કાર્પેટ એરિયા ૩७.૪૯ સ્કે. મીટર્સ, અવિભાજીત ૨૧.૦૬૦

સ્કે. મીટર્સ, સર્વે નં. ૧૩७, ટી.પી. ૧૨૮, એફ.પી. નં. ૬૧, મોજેઃ વટવા, સબ જીલોઃ અમદાવાદ–૧૧ (અસલાલી), જીલોઃ અમદાવાદ ની જમીન અને બિલ્ડીંગ ના બધા હક, ટાઈટલ અને હિસ્સા તેના પીસ અને પાર્સલ અને ચતુરસીમા આ મુજબ છેઃ ઉત્તરઃ મેઈન પ્રવેશ અને તે